

LL.B. Semester - 3 (CBCS) Examination
Oct/Nov - 2024 [As Per Syllabus Year July-2022]
Principles of Taxation Law & GST(Core)

Time: 03:00 Hours

Marks:100

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ કરવેરાના કાયદાનો ઐતિહાસિક વિકાસની ચર્ચા કરો. કરવેરાના કાયદાને લગતા મૂળભૂત સિદ્ધાંતોને તપાસો. (૨૦)
 અથવા
- પ્રશ્ન-૧ ટેક્ષની વ્યાખ્યા, સ્વરૂપ અને લાક્ષણિકતાઓની યોગ્ય ઉદાહરણો સાથે ચર્ચા કરો.
- પ્રશ્ન-૨ 'આવક' શબ્દને ટીકાત્મક રીતે તપાસો. કુલ આવક વિશે અને કુલ આવકમાં સમાવિષ્ટ ન હોય તેવી આવક વિશે વિગતવાર ચર્ચા કરો. (૨૦)
 અથવા
- પ્રશ્ન-૨ આવકના વિવિધ મથાળાની ચર્ચા કરો. આવકના જોડાણનો ખ્યાલ ઉદાહરણો સાથે ચર્ચો.
- પ્રશ્ન-૩ પગારમાંથી મુખ્ય આવક હેઠળ આવકવેરા માટે વસૂલવાપાત્ર આવકોની વિગતવાર ચર્ચા કરો. (૨૦)
 અથવા
- પ્રશ્ન-૩ ટેક્ષમાં કપાત, રાહત અને મુક્તિ સંબંધિત જોગવાઈઓ યોગ્ય ઉદાહરણો સાથે સમજાવો.
- પ્રશ્ન-૪ વિવિધ આવકવેરા સત્તાધીશો સમજાવો. તેમની સત્તાઓ અને કાર્યોની ચર્ચા કરો. (૨૦)
 અથવા
- પ્રશ્ન-૪ ગુનાની જોગવાઈઓ, દંડનીય પ્રતિબંધો અને ફરિયાદના નિરાકરણની ચર્ચા કરો.
- પ્રશ્ન-૫ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ કોઈપણ બે ટૂંક નોંધ લખો. (૨૦)
1. GSTનો ખ્યાલ, ઉદ્દેશ્ય અને બંધારણીય સુધારાઓ
 2. સંયુક્ત અને મિશ્ર પુરવઠો
 3. ઈ-કોમર્સ અને ઈ-કોમર્સ સંચાલક
 4. રજીસ્ટ્રેશન અને ટેક્સ ઇન્વોઇસ માટે દંડની જોગવાઈઓ

ENGLISH VERSION

- Que.1 Discuss the historical development of Tax Law. Examine the fundamental principles relating to Tax Law. (20)
 OR
- Que.1 Discuss the concept, nature and characteristics of taxes with suitable examples.
- Que.2 Critically examine the term 'Income'. Discuss in detail about total income and income not included on total income. (20)
 OR
- Que.2 Discuss the various heads of income. Discuss the concept of clubbing of income with examples.
- Que.3 Discuss in detail the Incomes that are chargeable to incomes tax under the head income from salaries. (20)
 OR
- Que.3 Explain the provisions regarding deduction, relief and exemption in tax with suitable examples.
- Que.4 Explain the various income Tax authorities? Discuss the powers and functions of them. (20)
 OR
- Que.4 Discuss the provisions of offence, penal sanctions and settlement of grievance.
- Que.5 Write any two short notes under the Goods and Service Tax- (20)
1. Concept, object and constitutional amendments in GST
 2. Composite and mixed supply
 3. E-commerce and E-commerce operator
 4. Penalty provisions for registration and tax invoice
